

**ZEAL AQUA LIMITED**  
**CIN No: L05004GJ2009PLC056270**



Date: 06/01/2026

To,  
**BSE LIMITED**  
Phiroze Jeejeebhoy towers,  
Dalal Street,  
Mumbai- 400 001.

Scrip Code : **ZEAL | 539963**  
Subject : **Intimation of Newspaper Advertisement of Postal Ballot**  
Reference No. : **Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.**

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Newspaper Advertisement regarding the Notice of Postal Ballot, E-voting information which is published in the below mentioned newspapers on Tuesday, January 06, 2026.

1. English Daily: "Free Press Gujarat" dated 06<sup>th</sup> January, 2026
2. Regional Language Daily: "Lokmitra" dated 06<sup>th</sup> January, 2026

The above information is also available on the website of the Company [www.zealaqua.com](http://www.zealaqua.com)

You are requested to kindly take the same on record.

Yours Faithfully,  
**Thanking you**

**For Zeal Aqua Limited**

**Anita Digbijay Paul**  
**Company Secretary and Compliance Officer**  
**FCS:9282**  
**Place: Surat**

Encl: Copies of Newspaper



# રેલવે સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા ઓટો ચાલકો સામે મોટી કાર્યવાહી



અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટો ચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવું તથા નિર્ધારિત દરો કરતાં વધુ ભાડું વસૂલવા અંગે સતત ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રેલવે

સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કમમાં આજે તા. ૦૪.૦૧.૨૦૨૫ના રોજ રેલવે સુરક્ષા બળ, અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવી નિયમોનું

ઉલ્લંઘન કરનાર ઓટો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન કુલ ૬ ઓટો ચાલકોના ઓટો જપ્ત કરવામાં આવ્યા તથા સંબંધિત ઓટો ચાલકો સામે રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી.

# ૧ ફેબ્રુ.થી સિગરેટ, બીડી, તમાકુના ઉત્પાદનો મોંઘા થશે બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેકસ અને સેસ

નવી દિલ્હી, સિગરેટ, બીડી, પાન મસાલા વગેરે જો તમારી લાઈફ સ્ટાઈલનો એક મહત્વનો ભાગ હોય અને તમને તેની આદત હોય તો તમારા માટે માફ સમાચાર આવ્યા છે. કારણ કે આ આદત તમને હવે મોંઘી પડી શકે છે. સરકારે તમાકુના ઉત્પાદનો પર એડિશનલ એક્સાઈઝ જ્યુટી લાદી છે. જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગૂ થશે. આ ઉપરાંત પાન મસાલા પર એક નવો સેસ લગાવવામાં આવ્યો છે અને તે પણ ૧ ફેબ્રુઆરીથી જ લાગૂ થશે. એટલે કે ૧ ફેબ્રુઆરીથી સિગરેટ, બીડી, પાન મસાલા જેવા તમાકુના ઉત્પાદનો મોંઘા થશે. આ વધારાની એક્સાઈઝ જ્યુટી ૪૦ ટકા જીએસટીથી અલગ છે. પાન મસાલા પર કેન્દ્ર સરકારે સેસ પણ લગાવ્યો છે. તે પણ ૪૦ ટકા જીએસટી દરથી અલગ છે. નવા નિયમો હેઠળ સરકારે પેકિંગ મશીનોની સહાયતાથી નિર્મિત અને પાઉચમાં પેક કરાયેલા ચાવવાના તમાકુ, જર્દા, સુગંધિત તમાકુ અને ગુટકાના કેન્દ્રીય એક્સાઈઝ જ્યુટી અધિનિયમની કલમ ૩ એ હેઠળ નોટિફાઈ કર્યું છે. નવા નિયમ હેઠળ સિગરેટની લંબાઈના આધારે દર ૧૦૦૦ સ્ટિક્સ પર ૨૦૫૦ રૂપિયાથી લઈને ૮૫૦૦ રૂપિયા સુધીની એક્સાઈઝ જ્યુટી લાગૂ થશે. તેના ઉપર ૪૦ ટકા જીએસટી પણ લાગૂ કરાશે એટલે કે તેની કિંમત બમણી થઈ શકે. આ ફેરફાર સાથે સરકારનો હેતુ તમાકુ પ્રોડક્ટ્સ પર ટેક્સ વ્યવસ્થાને વધુ મુશ્કેલ કરવાનો છે. જ્યાં સિગરેટ અને



પાન મસાલા પર ૪૦ ટકા જીએસટી લાગશે ત્યાં બીડી પર ટેક્સ ૧૮ ટકા રખાયો છે. આ ઉપરાંત પાન મસાલા મેન્ચુફેક્ચરિંગ યુનિટ્સ પર નવો હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ પણ લાગૂ કરાશે. આ સેસ મશીનોની ક્ષમતાના આધાર પર વસૂલ કરાશે. આ નિષ્ણય ટેક્સ ચોરીને રોકવા માટે લેવાયો છે. કેન્દ્ર સરકારે સિન ગાર્ડ્સ પર ૪૦ ટકા ટેક્સ લાગૂ કર્યો છે. પરંતુ હવે તેના પર લાગતા જૂના કમ્પન્સેશન સેસને ખતમ કરવાનું નક્કી કર્યું છે. જો કે તેની જગ્યાએ આ નવો સેસ લાગૂ થશે. જે હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ તથા

એડિશનલ એક્સાઈઝ જ્યુટી હશે. આ ફેરફાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગૂ થશે. ડિસેમ્બર ૨૦૨૫માં જ આ બંને બિલને મંજૂરી મળી ગઈ હતી અને સંસદમાં બિલ પાસ થયા હતા.

ગોલ્ડ ફ્લેક બનાવતી કંપની અને બજારમાં સૌથી મોટી સિગરેટ બનાવનારી કંપની આઈટીસીના શેરોમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ કંપનીના શેર અર્થ એ થયો કે કંપનીના શેર ૧૮ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ મહિનાથી વધુના લોઅર લેવલ પર પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ માર્લબોરોના રિફ્લીબ્યુટર્સ ગોર્ડફે ફિલિપ્સ ઈન્ડિયાના શેરોમાં ૧૫ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે કંપનીના શેર ૨,૩૩૫ રૂપિયા પર પહોંચ્યા જ્યારે બ્રુધવારે કંપનીના શેર ૨,૭૬૧.૫૫ પર હતા.

# પેન્ટાગનના રિપોર્ટ પર ભડક્યું ડ્રેગન ભારત-ચીનની વચ્ચે વિવાદ કરાવવા અમેરિકાનું કાવતરું?

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (નજ્જ) પર ઘટી રહેલા તણાવ અને સુધરી રહેલા સંબંધો વચ્ચે અમેરિકાના એક રિપોર્ટ નવો વિવાદ ઊડ્યો છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના ૨૦૨૫ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ભારત સાથે સંબંધો સુધારવાનો ‘ઢોંગ’ કરી રહ્યું છે જેથી ભારત અને અમેરિકાની નિકટતા અટકાવી શકાય. આ રિપોર્ટ પર ચીને આકરી પ્રતિક્રિયા આપતા તેને ભારત-ચીન વચ્ચે વિખવાદ ઊભો કરવાનું અમેરિકી કાવતરું ગણાયું છે.

# જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પાટણ, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળા, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમ આયોજિત આ કાર્યક્રમ દ્વારા સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે. રાસાયણિક ખેતીના કારણે ઊભી થયેલી આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં લેતાં પ્રાકૃતિક ખેતી આજના સમયમાં અત્યંત જરૂરી બની છે. પ્રાકૃતિક ખેતીથી સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકાય છે તેમજ જનતાને શુદ્ધ અન્ન અને શાકભાજી ઉપલબ્ધ કરાવી શકાય છે. ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીએ ખેતીના ઈતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રખર વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામીનાથને વધતી વસ્તી માટે પૂરતું



અન્ન ઉત્પન્ન કરવા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. તેના અનુસંધાને ડો. નોર્મન બોરલોગના માર્ગદર્શન હેઠળ શંકર બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને પૂરતા પાણીને આધારે પંજાબમાં કરાયેલા પ્રયોગો સફળ રહ્યા અને ૧૯૭૪ સુધીમાં ભારત ખાદ્યાન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું. જો કે લાંબા ગાળે રાસાયણિક ખેતીના દૂષપરિણામોને ધ્યાનમાં રાખીને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓએ પ્રાકૃતિક ખેતી વિષયક વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જમીનની ઉર્વરતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા તથા પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવાની મહત્વના પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વિવિધ કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી અંગે માહિતીસભર

વક્તવ્ય આપ્યા હતા, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર તથા મંજૂરી પ્રોગ્રાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ તથા મંચરચ મહાનુભાવોએ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી સંબંધિત ઉત્પાદનો, ટેકનિકસ અને નવીન પ્રયાસોની માહિતી મેળવી હતી. સાથે જ તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો અંગે ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલ, નિયામકશ્રી આર. કે. મકવાણા, ડો. પી. એસ. પટેલ (વિક્સરણ શિક્ષણ નિયામકશ્રી), દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, પ્રાંત અધિકારી શ્રી હિરેન ચોણણ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. બી. પટેલ, ગણપત અધિકારી શ્રી એમ. બી. ગલવાડીયા, આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એ. આર. ગામી સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

# એકબીજાને સોંપી મહત્ત્વની યાદી ૨૦૨૬ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી ઉપ વર્ષ જૂની પરંપરા




નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે ઉપ વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, સમજૂતી મુજબ બંને દેશોના રાજદ્વારીઓએ આજે એકબીજાને પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુરક્ષા સંબંધી માહિતીની આપ-લે કરી છે. બંને દેશોએ એકબીજાના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો અટકાવવા માટે એક કરાર કર્યો હતો, જેના ભાગરૂપે આ આપ-લે કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને પરમાણુ ફેસિલિટીઝની વિગતો એકબીજાને સોંપવા માટે ૩૧ ડિસેમ્બર-૧૯૮૮માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ આ સમજૂતી ૨૭ જાન્યુઆરી-૧૯૮૯માં લાગુ કરવામાં આવી હતી. સમજૂતી મુજબ બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીએ પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને તે સંબંધીત અન્ય માહિતી એકબીજાને શેર કરતા હોય છે. આમ બંને દેશોએ અત્યાર સુધીમાં કુલ ૩૪ વગર

માછીમારો અને ગુમ ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે છોડી મૂકવાની અને પરત મોકલવાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, ૧૬૭ ભારતીય માછીમારો અને સિવિલ કેદીઓની સજા પૂરી થઈ ગઈ છે, તેથી તેમને વહેલી તકે મુક્ત કરી ભારત પરત મોકલવામાં આવે. ભારતે એમ પણ કહ્યું છે કે, કસ્ટડીમાં રહેલા અને ભારતીય મનાતા ઉપ સિવિલ કેદીઓ અને માછીમારોને તાત્કાલીક કાઉન્સિલર એક્સેસ પણ આપવામાં આવે. ભારતે પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ છે, ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિ કરવામાં આવે.

# ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો, કમોસમી વરસાદ, ગાઢ ધુમ્મસથી ખેડૂતો ચિંતિત



નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆત ગુજરાતમાં હવામાનમાં મોટા પલટા સાથે થઈ છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદી છાંટા, ગાઢ ધુમ્મસ અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમી વિશ્લેષ ની અસરને કારણે આ પલટો આવ્યો છે, જેની અસર આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ધુમ્મસ અને ઠંડીએ લોકોને પરેશાન કર્યા છે. ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે, તો વાહનચાલકોને વિજિબિલિટી ઘટવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જવાહરપોર તાલુકાના મરોલી પંથક સહિત કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. હવામાનમાં ફેરફારને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો. ઠંડીના કારણે ઘણા લોકો ઘરમાં જ રહેવા મજબૂર થયા છે. બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદના સરહદી વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ડીસા, દાંતીવાડા, પાલવનર, ધાનેરા, હારીજ, જમડા, થરાદ, લોરવાણ, લુણાલે તેમજ લાખણીના કુડા, મોરાલ અને અમગધળા જેવા ગામોમાં વિજિબિલિટી ખૂબ ઘટી ગઈ. વાહનચાલકોએ લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું. ધુમ્મસ અને ઠંડીને કારણે ખેતીના પાકોમાં નુકસાનની ભીતિ વધી છે. બટાકા,

એરંડા, જીરું, રાયડો અને ઘઉં જેવા પાકોને રોગચાળાનું જોખમ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. મોરબલી પંથકમાં વહેલી સવારે તાપમાન ૧૪ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઠંડી અને ધુમ્મસને કારણે વિજિબિલિટી ઘટી, પરંતુ શિયાળુ પાકો માટે આ ઠંડી ફાયદાકારક છે. આ પ્રકારનું હવામાનથી ઘઉં સહિત અન્ય પાકોમાં ઉત્પાદન વધવાની આશા છે. ખેડૂતોમાં આનંદનો માહોલ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વાહનચાલકોને સાવધાની રાખવા અને ખેડૂતોને પાક રક્ષણ માટે તકેદારી લેવાની સલાહ આપવામાં આવી છે.

પાકિસ્તાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ફ્યુલેશનની અસરને કારણે, આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા

અને પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદથી જીરું, કિસમિસ, એરંડા, ઘઉં, ચણા, તુવેર, પાણા અને ઈસબગુલ સહિતના રવિ પાકોને નુકસાન થવાની આશંકા છે.

કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ધોરાજી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. પોરબંદર, દ્વારકા, કચ્છાણપુર, જૂનાગઢ, રાજકોટ અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાવ, થરાદ અને સુઈગામ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

જો આજે ફરી વરસાદ પડે તો કૃષિ પાકમાં ફૂગના રોગો જેવી સમસ્યાઓ ઊભી થશે. વધુમાં, કૃષિ નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે વરસાદ અને ભારે પવનના મિશ્રણથી પાકને નુકસાન થઈ શકે છે. હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને તેમના પાકને નુકસાનથી બચાવવા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. ખેડૂતોને ખુલ્લામાં બાકી રહેલા કોઈપણ કાપેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા વિનંતી કરવામાં આવી છે. તેમને તેમના પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકવા અને તેમના ખેતરોની આસપાસ માટીના પાળા બનાવવા પણ સૂચના આપવામાં આવી છે. ખાતર અને બીજને ભીના થવાથી બચાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

| સાંકેતિક કમજા નોટીસ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------|
| ICIICI Home Finance                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
| રજીસ્ટર્ડ ઓફિસ : આઈસીઆઈસીઆઈ એચએફસી ટાવર, જેબી નગર, અંબેડી કુર્લા રોડ, અંબેડી પૂર્વ, મુંબઈ- ૪૦૦૦૫૬<br>શાખા ઓફિસ : ત્રીજો માળ, ૩૦૧, નક્ષત્ર-૩, ૧૫૦ હિટ રોડ, રાવલપીંડી વિહાર અંબેડકરજી પાસે, રાંછકોટ- ૪૦૦૦૭૭                                                                                                                                                                                                                                                                     |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
| જ્યારે સિક્યોરાઈટીઝેશન, રિકન્સ્ટ્રક્શન ઓફ ઈઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટના નિયમ ૩ સાથે લેવાયેલા સેક્શન ૧૩ (૧૨) હેઠળ આપવામાં આવેલી સમાન ઉપયોગ હેઠળ આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરવામાં આવી છે. (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨, ઉલ્લેખિત રકમની ચુકવણી કરવા માટે નીચે દર્શાવેલ દેવાદારો પાસે ડિમાન્ડ નોટિસ ફાઈ કરી નોટિસમાં આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર. |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
| દેવાદાર રકમ ચુકવવામાં નિમ્ન ગયો હોવાથી, ઉપર લેનાર અને સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ તારીખો પર ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે લેવાયેલાં આવતી કલમ ૧૩(૧) હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી નીચે વર્ણવેલ મિલકતોને કબજે લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉપર લેનાર અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે મિલકત સાથે વ્યવહાર ન કરે અને મિલકત સાથે કોઈપણ વ્યવહાર આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડના ચાજને આપીન રહેશે.                        |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
| દેવાદારનું ધ્યાન કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ તરફ આકર્ષિત કરવામાં આવે છે, ઉપલબ્ધ સમયના સંદર્ભમાં, સુરક્ષિત સંપત્તિઓ ડીગ્રીમ કરવા માટે.                                                                                                                                                                                                                                                                                                                           |                                                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                   |
| ક્રમ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          | દેવાદારનું નામ/સહાયક-દેવાદારનું નામ/ લોન એકાઉન્ટ નંબર                                                                                         | મિલકતોની વિગતો / કમજાની તારીખ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       | ડિમાન્ડ નોટીસની તારીખ / ડિમાન્ડ નોટીસની રકમ (રૂ.) |
| ૧                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | ભાવિયા હરેશભાઈ કાનાભાઈ (દેવાદાર), ભાવળીયા ભાવુબેન હરેશભાઈ (સહ-દેવાદાર), કલસર કલસર સુરેન્દ્રનાથ સુરેન્દ્રનાથ ગુજરાત ઉદ ૩૫૨૦. LHRJA00001419878. | મિલકતનો તમામ ભાગ અને હિસ્સો જે પ્લોટ નંબર ૧ થી ૧૫, બીર મોખાતા નગર ખાતે, સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૧, જૂનો આર એસ નં. ૧૪, જોલી એન્ટરપ્રાઇસીસ સામે, ચોટીલાની બહાર, બાનગઢ રોડ, વિલ નવાગામ, તાલ ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનાથ, નવાગામ, સુરેન્દ્રનાથ- ઉદ ૩૫૨૦ પર સ્થિત છે. ચતુર્સીમા- ઉત્તર દ્વારા - લાગુ સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૦, દક્ષિણ દ્વારા - લાગુ સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૨, પૂર્વ દ્વારા - ૭.૫૦ મીટર પહોળો રોડ, પશ્ચિમ દ્વારા - લાગુ એસ નં. ૧૩ ની જમીન / કમજાની તારીખ- ૨-જાન્યુઆરી-૨૬ | 24-10-2025 Rs. 5,91,483/-                         |
| ૨.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | ભાવિયા હરેશભાઈ કાનાભાઈ (દેવાદાર), ભાવળીયા ભાવુબેન હરેશભાઈ (સહ-દેવાદાર), કલસર કલસર સુરેન્દ્રનાથ સુરેન્દ્રનાથ ગુજરાત ઉદ ૩૫૨૦. LHRJA00001420306. | મિલકતનો તમામ ભાગ અને હિસ્સો જે પ્લોટ નંબર ૧ થી ૧૫, બીર મોખાતા નગર ખાતે, સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૧, જૂનો આર એસ નં. ૧૪, જોલી એન્ટરપ્રાઇસીસ સામે, ચોટીલાની બહાર, બાનગઢ રોડ, વિલ નવાગામ, તાલ ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનાથ, નવાગામ, સુરેન્દ્રનાથ- ઉદ ૩૫૨૦ પર સ્થિત છે. ચતુર્સીમા- ઉત્તર દ્વારા - લાગુ સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૦, દક્ષિણ દ્વારા - લાગુ સબ પ્લોટ નંબર ૧ થી ૮૫ પાઈડી ૨૨, પૂર્વ દ્વારા - ૭.૫૦ મીટર પહોળો રોડ, પશ્ચિમ દ્વારા - લાગુ એસ નં. ૧૩ ની જમીન / કમજાની તારીખ- ૨-જાન્યુઆરી-૨૬ | 24-10-2025 Rs. 36,356/-                           |

ઉપરોક્ત દેવાદાર(ઓ)/જામીનદારોને રકમ ચુકવવા માટે ૩૦ દિવસની નોટિસ આપવામાં આવે છે. અન્યથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમો ૮ અને ૯ હેઠળની જોગવાઈઓ અનુસાર, આ નોટિસના પ્રકાશની તારીખથી ૩૦ દિવસની સમાપ્તિ પર ગૌરવ મૂકેલી મિલકતો વેચવામાં આવશે. તારીખ : જાન્યુઆરી ૦૬, ૨૦૨૬, સ્થળ : સુરેન્દ્રનાથ, અધિકૃત અધિકારી, આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ

# ઝીલ એક્વા લીમીટેડ

CIN: L05004GJ2009PLC056270  
રજીસ્ટર્ડ ઓફિસ : બ્લોક નં. ૩૪૭ ગામ: ઓરમા, તા: ઓલવાલ, સુરત - ૩૯૪૫૪૦, ગુજરાત, ટેલી.: +૦૨૬૧૧-૨૨૦૦૪૭.  
ઈમેઇલ આઈડી : zealacqua@gmail.com. વેબસાઇટ: www.zealacqua.com ,

**પોસ્ટલ બેલેટ નોટિસ**  
૫ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧૦ અનુસાર, જે કંપનીઓ (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ સુધારેલા સાથે લેવામાં આવે છે. આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે કલમ ૧૧૦ અને કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ") ની અન્ય લાગુ જોગવાઈઓ, જો કોઈ હોય તો, જે કંપનીઓ (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ ("વ્યવસ્થાપન નિયમો") સાથે લેવામાં આવે છે, (હાલ અમલમાં રહેલા કોઈપણ કાયદાકીય સુધારા અથવા પુનઃઅધિનિયમ સહિત), સામાન્ય પરિપત્ર નં. ૧/૪/૨૦૨૦ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, ૧/૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૨/૦૨/૨૦૨૦ તારીખ ૫ મે, ૨૦૨૦, ૨/૨/૨૦૨૦ તારીખ ૧૫ જૂન, ૨૦૨૦, ૩/૩/૨૦૨૦ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, ૩/૬/૨૦૨૦ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, ૧/૦૨/૨૦૨૧ તારીખ ૨૩ જૂન, ૨૦૨૧, ૨/૦/૨૦૨૧ તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૨૧, ૩/૨/૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨ અને ૧૧/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ કોર્પોરેટ બનાવતા મંત્રાલય (સામૂહિક રીતે "MCA પરિપત્રો" તરીકે ઓળખાતા છે) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("SEBI") (લિસ્ટેડ આપ્લિકેશન એન્ડ રિસ્કલોઝર રિસ્કવેશન-ન્ટ્સ) રેગ્યુલેશન ૪૪, ૨૦૧૫, ("SEBI LODR") અને SE



# How India's latest visa reforms are a pragmatic step

Parliament's passage of the Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India (Shanti) Act marks a structural break in India's civil nuclear governance. For the first time, private entities are truly and legally permitted to construct, own, operate, and decommission nuclear power plants in India. This reform corrects a fundamental market-design failure that had rendered nuclear power economically unbankable for over a decade. That failure

was liability design.

Nuclear energy is unique among infrastructure sectors because its defining risk is not operational volatility but catastrophic tail risk, ie, low-probability, extreme-consequence events that overwhelm conventional tort-based liability systems. In such domains, markets fail unless liability is carefully channelled, capped, and backstopped by the sovereign. Without this architecture, neither insurers nor lenders can price risk, and private

capital rationally stays away. India's earlier framework under the Civil Liability for Nuclear Damage Act (CLNDA), 2010, recognised this in form but undermined it in substance. While the Act adopted a no-fault regime with strict and capped liability on the operator (aligned in principle with global norms), it introduced a fatal distortion through Section 17(b), which created a statutory right of recourse against suppliers for latent defects or substandard services. This single provision broke liability channelling. By reopening supplier exposure without clear temporal limits, evidentiary thresholds, or contractual override, it transformed a capped regime into one with unbounded contingent liability.

From the standpoint of financial economics, this made nuclear risk uninsurable. Nuclear accidents are characterised by fat-tailed distributions, deep (Knightian) uncertainty, and correlated losses across geography and time. Private insurance markets rely on diversification and pooling; nuclear risk violates both conditions. Globally, this problem is solved not by forcing private actors to internalise the impossible, but by socialising catastrophic risk through statute-backed insurance pools and sovereign guarantees. Section 17(b) short-circuited that solution by injecting unquantifiable supplier risk upstream. The result was predictable: global vendors exited, domestic suppliers hesitated, insurers retreated, and lenders demanded sovereign guarantees that negated the very purpose of private participation.

The Shanti Act decisively dismantles this architecture. It repeals both the Atomic Energy Act, 1962, and the CLNDA, 2010. It also removes the statutory supplier liability clause in its entirety. Thus, the Act restores exclusive legal liability to the operator. Supplier responsibility is now a matter of private contract, not public tort. This distinction is decisive. Ex post statutory liability is unpriceable; ex ante contractual allocation is priceable. The former kills markets; the latter enables them. In doing so, India has aligned its domestic law with established international practice under the Vienna Convention and the Convention on Supplementary Compensation (CSC), to which India is already a party. The operator liability cap, set at 300 million Special Drawing Rights (SDR), is not an arbitrary dilution of accountability but a deliberate insurance-calibrated threshold. Its purpose is to ensure that liability remains within the envelope of what insurance markets can credibly cover. Indexing or judicially expanding this cap would not enhance justice; it would destroy insurability and collapse investment.

Crucially, the Shanti Act does not stop at liability channelling. It provides for the establishment of a Nuclear Liability Fund, introducing a second layer of risk pooling beyond the operator cap. This mirrors the logic of the US Price-Anderson Act, where primary operator insurance is supplemented by industry-wide pooling and, beyond that, a federal backstop. At the international level, the CSC adds a further layer of cross-border mutualisation. These mechanisms recognise a basic economic truth. Catastrophic nuclear risk is a public bad with non-excludable spillovers. It cannot be efficiently borne by individual firms without collapsing the market. Socialising tail risk then acts towards proving an enabling infrastructure.

The financial consequences of this correction are substantial. Under the previous regime, nuclear projects faced an artificially inflated weighted average cost of capital (WACC), driven not by technology or construction risk but by legal uncertainty at the

tail. Insurers priced conservatively or withdrew, suppliers embedded large risk premia into EPC contracts, and lenders insisted on sovereign guarantees. The outcome was not higher tariffs but project non-viability. Shanti collapses this risk premium by converting nuclear power from an uninsurable legal anomaly into a financeable infrastructure asset. This correction is especially

consequential for small modular reactors (SMRs). While SMRs may reduce absolute risk through passive safety systems and smaller core inventories, their economic model depends on serial manufacturing, standardised contracts, and fleet-wide replication. Under the old regime, a single latent defect claim could contaminate an entire reactor fleet. Shanti's clean

liability channel is therefore not merely compatible with SMRs; it is a precondition for their commercial deployment.

Critics argue that the Act "privatises profit while socialising liability." This critique misunderstands the nature of the risk in question. Routine operational risks remain firmly with private operators, who are subject to strict safety regulation,

licensing conditions, and capped liability. What is socialised is only the catastrophic tail risk that no private balance sheet can absorb and no insurance market can price. Refusing to socialise such risk does not protect the public; it simply

ensures underinvestment in clean, firm baseload power and pushes the system toward more polluting or geopolitically exposed alternatives. Shanti also draws a clear boundary between commercial and strategic domains.

## Symbiosis International opens application for undergraduate programmes




Ahmedabad, Symbiosis International (Deemed University) has opened registrations for the SET 2026 (Symbiosis Entrance Test) and SITEEE 2026 (Symbiosis Institute of Technology Engineering Entrance Exam) for admission to its full-time undergraduate programmes. Interested candidates can apply until April 15, 2026. Both SET and SITEEE are Computer-Based Tests (CBT) conducted by Symbiosis International (Deemed


University) for admission to a wide range of undergraduate programmes, including BBA, BCA, BA, BSc, and B.Tech across Symbiosis institutes. Candidates may opt for up to two test attempts, with the higher score considered for percentile calculation. SET 2026 serves as the gateway to 12 reputed Symbiosis undergraduate institutes across disciplines such as Management, Mass Communication, artificial intelligence, Economics, Applied Statistics & Data Science, Information Technology, Sport & Exercise Science, Computer Applications, Liberal Arts and more. These programmes are offered across campuses in Pune, Noida, Nagpur, Bengaluru, and Hyderabad. (20-4)

## A book A Dream of Billions: Road Safety 2.0 Launched

Ahmedabad, A significant milestone in India's road safety movement was marked with the launch of A Dream of Billions: Road Safety 2.0 by Mr. Akhilesh Srivastava, President of ITS India, Road Safety as well as president of the India Chapter of the International Road Federation (IRF), and Member of the NHEV Knowledge Group. Mr. Srivastava personally signed copies of the book during the launch reflecting his commitment to knowledge-sharing and citizen engagement in the evolving electric and smart mobility ecosystem. The book reframes road safety from a regulatory obligation to a shared national responsibility, advocating a technology- and people-centric approach that integrates AI, digital systems, and community participation.



It highlights the role of intelligent highways, Advanced Traffic Management Systems (ATMS), and data-driven enforcement in reducing road accidents and improving compliance. A Dream of Billions: Road Safety 2.0 was presented to Shri Nitin Gadkari, Union Minister for Road Transport and Highways, who appreciated the road safety initiatives of the India Chapter of IRF and emphasized the importance of technology-enabled solutions. (1-7)

**पावरग्रिड  
POWERGRID**

**NOTICE**  
1. Petition for determination of tariff under Section 62 read with Section 79 (1) (d) of Electricity Act, 2003 and under the Regulation 15 (1) (a) and Regulation 23 of Central Electricity Regulatory Commission (Conduct of Business) Regulations, 2023 read with Central Electricity Regulatory Commission (Terms and Condition of Tariff Regulations) 2019 and Central Electricity Regulatory Commission (Terms and Condition of Tariff Regulations) 2024 for Connectivity and LTA for 325 MW Wind Project of M/s SBESS Services Projects Private Limited" in Western Region.  
2. The beneficiaries of the above-mentioned Transmission system are: (1) Madhya Pradesh Power Management Company Ltd., Jabalpur (2) Chhattisgarh State Power Distribution Company Limited, Raipur (3) Gujarat Urja Vikas Nigam Ltd., Vadodara, (4) Electricity Department, Government of Goa, Panaji, (5) Maharashtra State Electricity Distribution Company Ltd., Mumbai, (6) DNHD Power Distribution Corporation Limited, Silvassa, (7) Adani Wind Energy MP One Private Limited, (8) Uttar Pradesh Power Corporation Ltd, (9) Ajmer Vidyut Vitran Nigam Ltd., (10) Jaipur Vidyut Vitran Nigam Ltd., (11) Jodhpur Vidyut Vitran Nigam Ltd., (12) Himachal Pradesh State Electricity Board Ltd, (13) Punjab State Power Corporation Limited, (14) Haryana Power Purchase Centre, (15) Jammu Kashmir Power Corporation Limited, (16) BSES Yamuna Power Ltd, (17) BSES Rajdhani Power Ltd, (18) Tata Power Delhi Distribution Ltd, (19) Uttarakhand Power Corporation Ltd, (20) North Central Railway (21) New Delhi Municipal Council, (22) Chandigarh Electricity Department, (23) Haryana Vidyut Prasaran Nigam Limited, (24) Central Transmission Utility Of India Ltd., (CTUIL)  
3. Tariff details:  
a) 2019-24 block (₹In Lakhs)  

| Asset Detail | DOCO/ ECOD | Completion Cost as on 31.03.2024 | 2019-20                        | 2020-21 | 2021-22 | 2022-23 | 2023-24 |        |
|--------------|------------|----------------------------------|--------------------------------|---------|---------|---------|---------|--------|
| Assets-1     | 29.04.22   | 3299.69                          | Revised AFC based on truing up | NA      | NA      | NA      | 706.48  | 854.11 |
| Assets-2     | 30.04.22   | 348.39                           |                                | NA      | NA      | NA      | 68.78   | 80.65  |

  
b) 2024-29 block (₹In Lakhs)  

| Asset Detail   | Completion Cost as on 31.03.2023 | 2024-25 | 2025-26 | 2026-27 | 2027-28 | 2028-29 |        |
|----------------|----------------------------------|---------|---------|---------|---------|---------|--------|
| Combined Asset | 3929.92                          | AFC     | 848.28  | 867.60  | 880.07  | 877.00  | 874.55 |

  
4. A copy this notice and of the application made for determination of tariff is posted on the website of the applicant at [www.powergrid.in](http://www.powergrid.in)  
5. The suggestions and objections, if any, on the proposals for determination of tariff contained in the petition may be filed by any person, including the beneficiaries, through the e-filing portal of the Commission or in writing before the Secretary, Central Electricity Regulatory Commission, 6th, 7th & 8th floor, Tower B, World Trade Centre, Naoraji Nagar, New Delhi - 110029 (or other address where the office of the Commission is situated), with a copy to the petitioner at the address of its corporate office within 30 days of publication of this notice.  
Place: Gurugram  
Date: 05.01.2026  
Sd/-  
Sr. Deputy General Manager (Commercial)

**POWER GRID CORPORATION OF INDIA LIMITED**  
(A Government of India Enterprise)  
Registered Office: B-9, Qutab Institutional Area, Katwaria Sarai, New Delhi 110 016  
Corporate Office: Saudamini, Plot No. 2, Sector-29, Gurugram, Haryana - 122 001  
[www.powergrid.in](http://www.powergrid.in), CIN : L40101DL1998G0013821  
**A Maharatna PSU**

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chamber, Mr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali fly crossing, mithakhali, ahmedabad.  
Editor : Mayur C. Bhatt

**WESTERN RAILWAY - VADODARA DIVISION**  
**E-AUCTION FOR THE CONTRACT OF NON - FARE REVENUE CONTRACTS (NFR) & PARKING**  
E-Auction for the contract for the "Non - Fare Revenue Contracts (NFR)" & Parking contract will be held on **16.01.2026**. The e-auction will start at **11:00 hrs. on 16.01.2026**. The catalogue has already been published on [www.ireps.gov.in](http://www.ireps.gov.in) website. The details are furnished as under:-  
**Catalogue No.: ADVT - BRC - 160126**

| Lot No.                                                                                                         | Description                                                                                                                                                                                                                                          | Contract period |
|-----------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------|
| ADVT-BRC-AKV-OH-290-25-6 (Advertising - Out of Home)                                                            | Contract for display of commercial advertisement by way of Hoardings in the circulating area (East & West side) of Ankleshwar Railway station.                                                                                                       | 5 years         |
| ADVT-BRC-VS-OH-92-25-5 (Advertising - Out of Home)                                                              | Display of Commercial advertisement by way of hoardings near ROB No. 5A at Mandvi side of Pratapnagar bridge in Vadodara city area.                                                                                                                  | 5 years         |
| ADVT-BRC-ANND-OH-10-25-5 (Advertising - Out of Home)                                                            | Contract for display of commercial advertisement by way of hoardings in the circulating area of Anand Railway station.                                                                                                                               | 5 years         |
| ADVT-BRC-PRTN-OH-17-25-2 (Advertising - Out of Home)                                                            | Contract for display of commercial advertisement by way of hoardings, boards & wall painting at different stations in Pratapnagar - Ektanagar section.                                                                                               | 5 years         |
| ADVT-BRC-CYI-OH-23-25-4 (Advertising - Out of Home)                                                             | Contract for display of commercial advertisement by way of Hoardings in the circulating area of Chhayapuri Railway station.                                                                                                                          | 5 years         |
| ADVT-BRC-EKNR-OH-21-25-4 (Advertising - Out of Home)                                                            | Contract for display of commercial advertisement by way of hoarding in the circulating area of Ekta Nagar Railway Station.                                                                                                                           | 5 years         |
| ADVT-BRC-GER-OSN-270-25-1 (Advertising - On Station Premise (Non-Digital))                                      | Contract for display of commercial advertisement by way of sign boards inside the station building at Gohaji, Mehamadabad Kheda Rd., Nenpur, Kanji, Barajadi & Geratpur stations of Nadiad-Geratpur section.                                         | 5 years         |
| ADVT-BRC-BRC-OSN-297-25-2 (Advertising - On Station Premise (Non-Digital))                                      | Contract for non-digital advertising through stickers on side wall of Escalators of Vadodara Railway station.                                                                                                                                        | 5 years         |
| ADVT-EFF-287390-1-25-2 (Advertising - Train Exterior (Full Face))                                               | Contract for display of Commercial advertisement on exterior portion of Gujarat Sampark KrantiExpress running between Ektanagar-Nizamuddin Express train no. 20945/20946 through vinyl wrapping.                                                     | 5 years         |
| ADVT-IntExt-86019-25-1 (Advertising - Train Interior and Exterior)                                              | Contract of display of Commercial Advertisements by way of vinyl wrapping on the exterior portion & transfer stickers in the interior portion of the Train No: 22929/22930 (Vadodara-Dahanu Road-Vadodara) express train.                            | 5 years         |
| PnU-BRC-BH-WRL-17-25-1 (Pay and Use - ounge/Waiting/ Retiring/ Cloak Rooms)                                     | Contract for Operation & Maintenance of Retiring Room, Upper-Class Waiting Room & Officer's Rest House (ORH) of Bharuch station and Operation & Maintenance of Retiring Room & Upper-Class Waiting Room of Ankleshwar & Kosamba Railway Stations.    | 3 years         |
| MSS-BRC-BRC-SIPod-51-25-1 (Misc-Static-Services - Sleeping pods at station)                                     | Contract for Development, Operation & Management of Multi-Functional Commercial Building (MFCB) at Two storey EI building structure available on the west side (alkapuri side) circulating area near Reservation office of Vadodara Railway Station. | 10 years        |
| MSS-BRC-BRC-TWnOPS-3-25-1 (Misc-Static-Services Two wheeler and other parcel packing services)                  | Contract for packing of Two Wheeler & Other Parcel Packing services with Photocopier kiosk near parcel office at Vadodara Railway Station.                                                                                                           | 3 years         |
| MSS-BRC-BRC-THDPK-54-25-1 (Misc-Static-Services - Travel Help Desk/Travelers Information and Promotional Kiosk) | Information and Promotional Kiosk in Concourse Hall (East side) area of Vadodara Railway Station.                                                                                                                                                    | 5 years         |
| MSS-BRC-ANND-KStnGP-53-25-1 (Misc-Static-Services - Grocery, Photocopier Kiosk)                                 | Allotment of contract for setting up and operation of Grocery, Photocopier kiosk at Anand Railway Station.                                                                                                                                           | 5 years         |
| MSS-BRC-BH-KStnGP-55-25-1 (Misc-Static-Services - Grocery, Photocopier Kiosk)                                   | Allotment of contract for setting up and operation of Grocery, Photocopier kiosk at Platform No.2/3 of Bharuch Railway Station.                                                                                                                      | 5 years         |
| MSS-BRC-BH-STGen-56-25-1 (Misc-Static-Services - Static General)                                                | Contract for Development, Operation and Maintenance of Digital Lounge/Co-working space with modern facilities at Platform No.2/3 of Bharuch Railway Station.                                                                                         | 5 years         |
| MSS-BRC-EKNR-STGen-57-25-1 (Misc-Static-Services - Static General)                                              | Contract for Development, Operation and Maintenance of Digital Lounge/Co-working space with modern facilities at Viewing Gallery of Ektanagar Railway Station.                                                                                       | 5 years         |
| MSS-BRC-BH-STGen-58-25-1 (Misc-Static-Services - Static General)                                                | Contract for Development, Operation and Maintenance of Digital Lounge/Co-working space with modern facilities at the Clock Tower of Bharuch Railway Station.                                                                                         | 5 years         |
| <b>Catalogue No.: C481 - BRC - 160126</b>                                                                       |                                                                                                                                                                                                                                                      |                 |
| PARKING-BRC-ND-MX-17-25-5 (Parking - Mixed)                                                                     | Parking Lot for Two Wheelers and Four Wheelers Under One Licence at East Side of Nadiad Railway Station in (Division VADODARA)                                                                                                                       | 3 years         |
| <b>BRC 308</b>                                                                                                  |                                                                                                                                                                                                                                                      |                 |

**Like us on:** [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) **Follow us on:** [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

**SYMBOLIC POSSESSION NOTICE**  
**ICICI Home Finance** Registered Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai- 400051  
Corporate Office: ICICI HFC Tower, JB Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbai- 400059  
Branch Office: 3rd floor, 301, Nakshatra-3, 150 Ft Ring Road, Near Raoya Telephone Exchange, Rajkot- 360007  
Whereas  
The undersigned being the Authorized Officer of ICICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.  
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 3 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Home Finance Company Limited.  
The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.The above-mentioned borrowers(s) guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.  
Date: January 06, 2026  
Place: Surendranagar  
Authorized Officer  
ICICI Home Finance Company Limited

**ZEAL AQUA LIMITED**  
CIN: L05004GJ2009PLC056270  
Registered Office: Block No. 347, Vill. Orma, Ta: Olpad, Surat-394540, Gujarat  
Tel.: +02621-220047; Website: [www.zealaqua.com](http://www.zealaqua.com)  
Email Id: [zealaqua@gmail.com](mailto:zealaqua@gmail.com)

**POSTAL BALLOT NOTICE**  
[Pursuant to Section 110 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 as amended]  
Notice is hereby given that pursuant to the provisions of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014 (the "Management Rules"), (including any statutory modification or re-enactment thereof for the time being in force), General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and Regulation 44 of the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("SEBI LODR") and other applicable provisions, if any, of the SEBI LODR, for the time being in force and as amended from time-to-time and Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India, the approval of members of **Zeal Aqua Limited** is sought for the special resolution set-out below which is proposed to be passed by way of Postal Ballot by voting through electronic means only ("Remote e-voting"):  

| Description of Special Resolution                                                                                                    |
|--------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <b>APPOINTMENT OF MR. PANKAJBHAI CHIMANLAL PATEL (DIN-11371266) AS A NON-EXECUTIVE INDEPENDENT DIRECTOR FOR A TERM OF FIVE YEARS</b> |

  
Pursuant to the MCA Circulars, the Postal Ballot Notice accompanied by the explanatory statement has been dispatched by electronic means only to those members whose e-mail addresses are registered with the Company / depositories as on **Friday, January 02, 2026 ("Cut-off Date")**. The same is also available on the Company's Website <https://zealaqua.com>, website of stock exchanges (BSE Limited) at [www.bseindia.com](http://www.bseindia.com) on the website of National Securities Depository Limited ("NSDL") <https://www.evoting.nsdl.com/>.  
The Company has engaged the services of NSDL to provide e-voting facility to its members. The e-voting period commences from **9.00 a.m. (IST) on Thursday, January 08, 2026, and ends at 5.00 p.m. (IST) on Saturday, February 07, 2026**. The e-voting facility will be disabled thereafter. The voting rights of members shall be in proportion to their holding of equity shares with the paid-up equity share capital of the Company as on the Cut-off Date. Only those members whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the depository participant(s) as on the Cut-off Date will be entitled to cast their votes by e-voting. A person who is not a member as on the Cut-off Date should treat this Postal Ballot Notice for information purposes only.  
The Board of Directors on January 05, 2026, has appointed Mr. Dhaval P. Master (Membership No. A34204), Partner of JDM & Associates LLP (LLPIN - ACO-1243), Practicing Company Secretaries, as the Scrutinizer (the "Scrutinizer") to conduct the postal ballot e-voting process in a fair and transparent manner.  
In case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads sections of <https://www.evoting.nsdl.com> or contact NSDL at the following toll-free no.: 022 - 4886 7000.  
The result of postal ballot will be announced not later than two working days from the conclusion of the e-voting and shall be intimated to BSE. The results would also be uploaded on the Company's website: [www.zealaqua.com](http://www.zealaqua.com) and on NSDL's website: [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com).  
By order of the Board of Directors  
For Zeal Aqua Limited  
Sd/-  
Anita Digbijay Paul  
Company Secretary & Compliance Officer

**TRUHOME FINANCE LIMITED**  
(Formerly Known As Shriram Housing Finance Limited)  


|                                                                                                                                                                                                                                                                                                                                                             |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <b>Reg. Off.:</b> Srinivasa Tower, 1st Floor, Door No. 5, Old No.11, 2nd Lane, Cenatophia Road, Alwarpet, Teyyanpet, Chennai-600018<br><b>Head Office:</b> Level 3, Wockhardt Towers, East Wing C-2, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai-400051<br><b>Website:</b> <a href="http://www.truhomefinance.in">http://www.truhomefinance.in</a> |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|

  
**PHYSICAL POSSESSION NOTICE**  
Whereas, The undersigned being the authorised officer of Truhome Finance Limited (Earlier known as Shriram Housing Finance Limited) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand notices.  
The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned being the Authorised officer Truhome Finance Limited (Earlier known as Shriram Housing Finance Limited) has taken PHYSICAL POSSESSION of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on 04.01.2026.  
The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Truhome Finance Limited (Earlier known as Shriram Housing Finance Limited) for an amount as mentioned herein below in invited thereon.  
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

| Borrower's Name and Address                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1). Shaival Sunil Parikh,<br>Present Address :- 20 'Pravinkunj', Navjivan Kalyan Society, Near Medisurge Hospital, Near Mithakhali, Ellisbridge, Ahmedabad-380006<br>Also :- 1.2) Shaival Sunil Parikh,<br>Business Address :- C/O. S.P.Enterprises Block-A, Shop No.1301, Mondeal Heights, Near Wide Angle Cinema, Opp.Karnavati Club,S.G.Highway, Ahmedabad-380015<br>Also :-1.3) Shaival Sunil Parikh,<br>Property Address No.1 :- Flat No.D-101, 1st Floor, Avadh City, Opp.ITI College, Near New Over Bridge, Bechradi Road, Viramgam, Ahmedabad-382150<br>Also :- 1.4) Shaival Sunil Parikh,<br>Property Address No.2 :- Bungalow No.34, Avadh City, Opp.ITI College, Near New Over Bridge, Bechradi Road, Viramgam, Ahmedabad-382150<br>2). Takshita Sunil Parikh,<br>Present Address :- 20 'Pravinkunj', Navjivan Kalyan Society, Near Medisurge Hospital, Near Mithakhali, Ellisbridge, Ahmedabad-380006<br>Also :- 2.2). Takshita Sunil Parikh,<br>Property Address No.1 :- Flat No.D-101, 1st Floor, Avadh City, Opp.ITI College, Near New Over Bridge, Bechradi Road, Viramgam, Ahmedabad-382150<br>Also :- 2.3). Takshita Sunil Parikh,<br>Property Address No.2 :- Bungalow No.34, Avadh City, Opp.ITI College, Near New Over Bridge, Bechradi Road, Viramgam, Ahmedabad-382150 |
| Amount due as per Demand Notice                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               |
| Rs.43,95,617/- (Rupees Fourty Three Lakh Ninety Five Thousand Six Hundred Seventeen Only) as on dated. 07.04.2025 under reference of Loan Account No. SHLHAHA0000404 with further interest and other costs, charges and expenses.<br>13(2) demand notice dated.15.04.2025<br>Physical possession taken dated.04/01/2026<br>Hon'ble Add. Chief Judicial Magistrate Court, Viramgam in Criminal Misc. Application No.300 of 2025 Dated 06/11/2025                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               |
| Description of Mortgaged Property                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             |
| Schedule-A: All that piece and parcel of Immovable Residential Property being Bungalow No.34 admeasuring around 196.79 Sq.Mtrs. land in the scheme known as "AVADH CITY", on the land of Revenue Survey No.302 of Mouje : Viramgam, Sub District & District : Ahmedabad-382150.<br>Boundaries of the property:- East : Bungalow No.33, West : Society Road<br>North : Bungalow No.35, South : Society Road<br>Schedule-B: All that piece and parcel of Immovable Residential Property being Flat No.D-101, admeasuring around 116 Sq.Yard. land in the scheme known as "AVADH CITY" on the land of Revenue Survey No.302 of Mouje : Viramgam, Sub District & District : Ahmedabad-382150.<br>Boundaries of the property:- East : Flat No.D/104, West : Internal Road & Block No.F<br>North : Flat No.D/102, South : Road & Common Plot                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        |
| Place: Viramgam-Ahmedabad<br>Date : 04/01/2026<br>Sd/-<br>Authorized Officer- Truhome Finance Limited<br>(Earlier known as Shriram Housing Finance Limited)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |